

## વિજીલન્સ ખાતુ

### અમદાવાદ ભ્યુનિસિપલ કોર્પોરેશન

### માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫

માહિતી પુસ્તીકા

( સને. ૨૦૨૦-૨૧ )

અધતન કર્યા તારીખ : ૦૧.૦૫.૨૦૨૦ ની સ્થિતિએ

વિજીલન્સ ખાતુ

અમદાવાદ ભ્યુનિસિપલ કોર્પોરેશન,

૧, લો માળ , “ સી ” બ્લોક , સરદાર પટેલ ભવન,

દાણાપીઠ , અમદાવાદ-૩૮૦ ૦૦૧

ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૮૯૮૧૧.

## પ્રસ્તાવના :-

માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિજ્ઞલન્સ ખાતાને જાહેર સંગઠન તરીકે જાહેર કરવામાં આવેલ છે. વિજ્ઞલન્સ ખાતાની કામગીરી, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ના વહીવટતંત્ર માં તેનું સ્થાન, ફરજો અને જવાબદારીઓ અંગે જાહેર જનતાને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્ર અંગે સામાન્ય પ્રજામાં સાચી સમજ પ્રવર્તે તથા કઈ પ્રકારની રજુઆત કરી શકાય તે અંગેની વ્યાપક માહિતી ઉપલબ્ધ થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્રની કામગીરી વધુ સરળ, વ્યાપક તેમજ લોકાભિમુખ બને તે હેતુસર આ પુસ્તીકા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સાથે જેમને રોજ- બરોજની કામગીરી રહેતી હોય તેવા તમામ નાગરીકો ને તેઓની કામગીરી સરળ અને ઝડપી બને તેમજ જાહેર સેવક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રી અને કર્મચારીઓને લાગુ પડતા વર્તણૂક ( શિસ્ત અને અપીલ ) નિયમો સબંધમાં તેઓની જવાબદારી અને ફરજ પ્રત્યે વ્યાપક સમજ પ્રવર્તે તે હેતુથી આ પુસ્તિકા પ્રકાશન કરવામાં આવેલે.

વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગેની સંપૂર્ણ વિગતો આ પુસ્તીકામાં આપવામાં આવેલ છે. તેમ છતાં વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગે વધુ માહિતી આવશ્યક હોયતો નીચે જણાવેલ અધિકારીશ્રીઓનો સંપર્ક કરવો

### ૧. શ્રી અંકિતા એમ મોહી

જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ્ઞ.જનરલ.)  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૪,

### ૨ શ્રી શૈલેષભાઈ ભંડ

જાહેર માહિતી અધિકારી અને આસી.સી.ટી.એન્જી. (ટેકનીકલ)  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૮

### ૩ શ્રી સંજ્યભાઈ ગજ્જર

જાહેર માહિતી અધિકારી અને (ઇન.ચાર્જ)આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

### ૪ શ્રી હીના એસ ભાથાવાલા

અપીલ અધિકારી અને ડાયરેક્ટર/ હેડ ઓફ ટીપાર્ટમેન્ટ (વિજ્ઞલન્સ),

અમદાવાદ મહાનગર સેવા સરદાન  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, બીજો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૯૯૮૮/૬૫૮

વધુમાં આ પુસ્તીકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે વિજ્ઞલન્સ ખાતાના જાહેર માહિતી અધિકારીશ્રીને લેખિત અરજી કરી તે અંગેની રાજ્ય સરકારે મુકરર કરેલી ફી ચુકવી નિયત સમય મર્યાદામાં અરજદાર જરૂરી માહિતી પોતાના દશાવિલ સરનામે મેળવી શકે છે. જો આ માહિતી સક્ષમ સત્તાને જાહેરહીતમાં આપવી યોગ્ય નથી જણાયતો તે અંગેની અરજદારશ્રીને લેખીતમાં જાણ કરવામાં આવશે.

## ૧. વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજો :-

અમદાવાદ ખુનિ.કોપોરિશનનાં તમામ ખાતાઓની નિયમિતતા બાબતની દેખરેખ, અમદાવાદ ખુનિ. કોપોરિશન ના તમામ વહીવટી તથા ટેકનીકલ ખાતાઓના અધિકારી/કર્મચારીઓ વિરુધ આવેલ ભણ્ણાચાર અને ગેરરીતીઓને લગતી ફરિયાદોની તપાસ કરી યોગ્ય નિકાલ કરવાની, તથા ખુનિ.કોપોરિશનના વિવિધ ખાતાઓના કર્મચારીઓનું હાજરી ચેકીંગ કરી, ખાતાઓને કાર્યક્ષમ રાખવાની કામગીરી ખુનિ. કમિશનરશ્રી ની સીધી દેખરેખ તથા રાહબરી હેઠળ વિજિલન્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- ખુનિસિપલ અધિકારી / કર્મચારીએ અયોગ્ય હેતુ કે લાંચ, ભણ્ણાચાર, ગેરરીતી આચરી કોઈ કામ કે વ્યવહાર કર્યાનો કોઈ આક્ષેપ હોયતો તપાસ કરી શકેછે.
- ખુનિસિપલ અધિકારી / કર્મચારીશ્રીએ અયોગ્ય હેતુ કે, લાંચરૂશત, ભણ્ણાચાર, ગેરવર્તણૂક અને ગેરરીતી કરી હોય અથવા તો આવા હેતુસર પોતાની સત્તાનો દુર ઉપયોગ કરેલ હોય, તો તેવી મળેલ ફરીયાદ બાબતે તપાસ કરી શકેછે.
- ખુનિસિપલ કોપોરિશનના ખાતાઓની વહીવટી કાર્યપદ્ધતી અને પ્રણાલી પ્રથાઓની સમીક્ષા કરી શકેછે.
- વિજિલન્સ ખાતાની કામગીરી (૧) જનરલ (૨) ટેકનીકલ (૩) એસ્ટેટ / ટી.ડી.ઓ. વિભાગ એમ ગ્રામ વિભાગમાં વહેંચાયેલી છે.

## (અ) જનરલ વિભાગ :-

- અમદાવાદ ખુનિ.કોપો.ના રેવન્યુ તથા નોન રેવન્યુ મળી રૂપ જેટલા જુદા જુદા ખાતાઓ તથા શેઠ વા.સા.જનરલ હોસ્પીટલ, શેઠ લ.ગો. ખુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રીમતિ શા.ચી.લા.ખુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રી ચી.દ.નગરી ખુનિસિપલ આંખની હોસ્પીટલ, ટી.બી.હોસ્પીટલ, દવાખાનાઓ, પ્રસુતિગૃહો, રેફરલ હોસ્પીટલો તેમજ એન.એચ.એલ. ખુનિસિપલ મેડીકલ કોલેજ, સ્વાધીન ડેન્ટલ કોલેજ દ્વારા અપાતી સેવાઓ બાબતે શહેરી નાગરીકો, સરકારી - બિન સરકારી સંસ્થાઓ, રાજકીય પદાવિકારીઓ તેમજ ખુનિ.કોપો. ના ઉચ્ચ અધિકારીઓ તરફથી આવતી ફરીયાદોનો નિકાલ વિજિલન્સ ખાતાના જનરલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- વિજિલન્સ ખાતાના જનરલ વિભાગને લગતી પ્રાથમિક તપાસની કામગીરી માટે ૦૧-૩.ડાયરેક્ટર, ૦૨-આસી.મેનેજર, ૦૩- વિજિલન્સ ઓફિસર (જનરલ) અને ૧૪ આસી. વિજિલન્સ ઓફિસર મળી કુલ-૨૦ અધિકારીઓની જગ્યાઓ મંજુર થયેલ છે, જે પૈકી આસી.મેનેજરની ૦૧ જગ્યા, વિજિલન્સ ઓફિસરની ૦૨ જગ્યા અને આસી.વિજિલન્સ ઓફિસરની ૦૮ જગ્યા મળી કુલ-૧૧ જગ્યાઓ હાલમાં ખાલી છે.

(૧) ડાયરેક્ટર/ એચ.ઓ.ડી. દ્વારા થતી કામગીરીઓ :-

- વિજ્ઞલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી
- વર્ગ-૦૧, ૨ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના જનરલ વિભાગ, અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીકેનિકલ વિભાગ તેમજ ઈજનેરના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો, વિજ્ઞલન્સ ઓફીસરો અને આસી. વિજ્ઞલન્સ ઓફીસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મુકવાની કામગીરી.

(૨) આસી.મેનેજર (જન.૦૧) અને આસી.મેનેજર (જન.૦૨) દ્વારા થતી કામગીરીઓ :-

- ચુનિ.કોર્પો.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ કોન્ઝરવન્સી સર્વિસીસ વિભાગ, પાર્કસ એન્ડ ગાર્ડન, સેન્ટ્રલ રેકર્ડ તથા ટેન્ડર ઓફીસ, સેન્ટ્રલ વર્કશોપ, સેન્ટ્રલ સ્ટોર્સ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ, ચુનિ.હોસ્પિટલો (તમામ) પ્રસુતિગૃહો / દવાખાના, કુટુંબ કલ્યાણ / આર.સી.એચ. સેવાઓ, ફાયર શ્રીગેડ, સ્નાનાગાર, ચુનિ.ઓફિસ, કાંકરીયા લેક, ઝુ, બાલવાટીકા, એમ.જે.લાયબ્રેરી, સી.એન.સી.ડી., સ્લોટર હાઉસ, જન્મ મરણ, મેલેરીયા, ચુનિ.મેડીકલ કોલેજો, હેલ્થ, એ.એમ.ટી.એસ; સેન્ટ્રલ ઓફીસ, સેન્ટ્રલ લેબોરેટરી, ઈ-ગર્વનન્સ (સિવીક સેન્ટરો ) અને એકાઉન્ટ ખાતા વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
  - ઈલેક્ટ્રીકલ એન્ડ મીકેનિકલ, પાવર પ્લાન્ટ, વોટર ઓપરેશન જેવા ખાતાઓમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
  - ચુનિ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના અધિકારીઓ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની બઢતી અને નિવૃત્તિ વખતે તથા પાસપોર્ટ કઢાવવા માટે વિજ્ઞલન્સ ખાતાની એન.ઓ.સી આપવા અંગેની કામગીરી.
  - ચુનિ.કોર્પો.ના વીકલ ટેક્ષ, યુ.સી.ડી, મધ્યાહન ભોજન યોજના, ઈલેક્શન, બાલભવન, પુસ્તકાલય, વ્યાયામ વિધાલય, પ.વ.એકાઉન્ટ, પ્રોપર્ટી ટેક્ષ, ઈ.શી; આઈ.આર; લીગલ, પબ્લિકીસીટી, સ્કૂલબોર્ડ, માધ્યમિક શાળાઓ, પ્રોફેશનલ ટેક્ષ, ગુમાસ્તાધારા, ઓડીટ, સેકેટરી અને પ્લાનીગ ખાતા વિરુધ્યની ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
  - એસ.ટી.પી. અને એસ્ટેટ-ટી.ડી.ઓ. ખાતામાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ્ય આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
- 
- આસી.મેનેજર (વિજ્ઞલન્સ જનરલ - ૦૧) ની જગ્યા હાલમાં ખાલી છે.

## (બ) ટેકનીકલ વિભાગ :-

વિજ્ઞલન્સ ખાતાના ટેકનીકલ વિભાગની કામગીરી ગ્રાણ પેટા વિભાગમાં વહેચાયેલ છે. (૧) એન્જનીયરીગ વિભાગ (૨) એસ્ટેટ-ટી.ડી.ઓ. વિભાગ (૩) ઇલેક્ટ્રોકલ એન્ડ મીકેનીકલ વિભાગ.

### ૧. એન્જનીયરીગ વિભાગ :-

- ખુનિ.કોપોરેશનના ૦૯ ઝોન દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં ૦૧ ડેઢુટી સીટી એન્જનીયર તથા આસી.સી.ટી.એન્જ. (ટેકનીકલ) ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડાયરેક્ટર વિજ્ઞલન્સ મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

### ૨. ઇલેક્ટ્રોકલ એન્ડ મીકેનીકલ વિભાગ :-

- આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ઇ એન્ડ એમ)ની જગ્યા હાલમાં ખાલી છે.
- આ વિભાગમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસની કામગીરી આસી.મેનેજર (જન.૦૨) દ્વારા કરવામાં આવે છે તથા પ્રાથમિક તપાસના રીપોર્ટ ડાયરેક્ટર વિજ્ઞલન્સ મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

### ૩. એસ્ટેટ/ ટી.ડી.ઓ. વિભાગ :-

#### આસી.ખુનિ.કમિશનર(વિજ્ઞલન્સ) દ્વારા થતી કામગીરીઓ :-

- વિજ્ઞલન્સ ખાતાની એસ્ટેટ / ટી.ડી.ઓ. વિભાગની તમામ વહીવટી કામગીરી
- વિજ્ઞલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજ્ઞલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ ના આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવાની કામગીરી.

ખુનિ.કોપોરેશનના એસ્ટેટ / ટી.ડી.ઓ. ખાતાઓ દ્વારા થતી કામગીરીઓની દેખરેખ રાખવા, ખુનિ.કોપોરેશનની હદમાં થતા ગેરકાયદે બાંધકામો / દબાણો દૂર કરાવવા તથા એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાના ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં આસી ખુનિ કમિશનર (વિજ્ઞલન્સ) , આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ. ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ઇન્સ્પેક્ટર/સબ ઇન્સ્પેક્ટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

## અ. જનરલ વિભાગ:

### ૦૧. ડાયરેક્ટર(વિજીલન્સ) :-

- ખુનિ.કમિશનરશ્રી,ડે.ખુનિ.કમિશનર(વિજીલન્સ)તેમજ દરેક ઝોનના ડે.ખુનિ.કમિશનરશ્રી તરફથી સોપવામાં આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તેમજ નાગરીકો તરફથી આવતી ફરીયાદોનો તાકીદે નિકાલ કરવાની કામગીરી મેનેજરશ્રી દ્વારા કરવામાં આવે છે.
- **વિજીલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી**
- વર્ગ-૦૧-૨ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગ, અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીડીનીકલ તેમજ (ઈજનેર) વિભાગના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો, વિજીલન્સ ઓફીસરો અને આસી.વિજીલન્સ ઓફીસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મુકવાની કામગીરી.

### ૦ ૨. આસી.મેનેજર :-

- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓને સોપવામાં આવેલ ખાતાઓની બ્રાષાચાર,ગેરરીતી, તેમજ બેદરકારીની આવતી ફરીયાદોનો યોગ્ય તપાસ કરી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે.તેમજ તેઘુટી ખુનિસિપલ કમિશનરશ્રી (વિજીલન્સ)ની સુચના મળ્યેથી જુદા જુદા ખાતાઓના સ્ટાફની હાજરી ચેકીગની કામગીરી કરવામાં આવે છે.
- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓના તાબા હેઠળ કામ કરતા તમામ સ્ટાફનું સંચાલન તથા માર્ગદર્શન ની કામગીરી કરવામાં આવે છે.ઉપરાંત તેમને સોપવામાં આવેલ ખાતાઓ અંગે આવતી આર.ટી.આઈ.અરજીઓનો જરૂરી માહીતી આપી નિકાલ કરવામાં આવે છે.
- તદૃઉપરાંત વખતો વખત ખુનિ.કમિશનરશ્રી તથા ડે.ખુનિ.કમિશનરશ્રીઓ તરફથી સોપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

### ૦૩. વિજીલન્સ ઓફિસર (જનરલ):-

- સક્ષમ સત્તા દ્વારા વિજીલન્સ ખાતે મોકલવામાં આવતી ફરીયાદો બાબતે આસી.મેનેજરશ્રીની સીધી દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરી ચેકીગ કરી સાચી હકીકતોનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- ખુનિસિપલ કોરોનિશનના વહીવટી ખાતાઓનાં અધિકારી / કર્મચારીઓ વિરુધ્ધ આવેલ ફરીયાદોની પ્રાથમિક તપાસ કરી તેનો હકીકતલક્ષી રિપોર્ટ આસી.મેનેજરશ્રી દ્વારા સક્ષમ સત્તાને કરવો.
- ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી વખતો વખત સોપવામાં આવે તે કામગીરી વિજીલન્સ - ઓફિસર (જનરલ ) દ્વારા કરવામાં આવે છે.

### ૦૪. આસી.વિજીલન્સ ઓફિસર (જનરલ) :-

- તમામ જોનનાં વહીવટી ખાતાઓના અધિકારી / કર્મચારીઓ સામે થયેલ ભષણાચાર અને ગેરરીતીઓને લગતી થયેલ ફરીયાદોની તપાસ કરી નિકાલ કરવો તથા સ્ટાફનું હાજરી ચેકીંગ કરવું.
- ખુનિ. જનરલ હોસ્પીટલો તથા કોપેરિશન સંચાલીત તમામ દવાખાનાઓને લગતી ફરીયાદોમાં પ્રાથમિક તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- તદ્વારાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૦૫. સીનીયર કલાર્ક્સ:-

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય ,તેમજ કન્ટીજન્સી વગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.એન.ઓ.સી.આપવાની કામગીરી, આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટ્સ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટ્સની ગુપ્તતા જાળવવી.

#### ૦૬. જુનીયર કલાર્ક્સ:-

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય ,તેમજ કન્ટીજન્સી તથા આર.ટી.આઈ.વિગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.ઇન્વર્ડ/આઉટવર્ડ,બિલકલાર્કની કામગીરી,રેકર્ડકીપિંગની કામગીરી

#### ૦૭. સેનેટરી સબ-ઇન્સ્પેક્ટરઃ :- (હાલમાં જગ્ગા ખાલી)

- તમામ હેલ્થ મસ્ટર સ્ટેશનોનું હાજરી ચેકીંગ તથા ઉપરી અધિકારીશ્રી તરફથી હેલ્થ ખાતાને લગતી વખતો વખત સોંપવામાં આવતી ફરીયાદોની તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.

#### ૦૮. ટાઈપીસ્ટ-કમ-કલાર્ક્સ:- (હાલમાં જગ્ગા ખાલી)

- આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટ્સ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટ્સની ગુપ્તતા જાળવવી.
- તદ્વારાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવામાં આવે છે.

#### ૦૯. સ્ટેનો :-(હાલમાં જગ્ગા ખાલી છે)

#### ૧૦. સર્વેબોય / પટાવાળા:-

- ખાતાની ટપાલ અન્ય ખાતે પહોંચાડવાની કામગીરી ઉપરાંત ખાતાના અધિકારી/કર્મચારી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૧૧. વિજિલન્સ ઓફિસર (લાઈટ (ઇન્ડાન્ડાન્ડ):- (હાલમાં જગ્ગા ખાલી)

## બ. ટેકનીકલ વિભાગ:-

### ૦૧. ડેયુટી સીટી એન્જિનીયર (વિજ્ઞાનસ) :-

- ખુનિ.કોપોરિશનના ઈજનેર વિભાગ દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞાનસ ખાતામાં ૦૧ ડેયુટી સીટી એન્જિનીયર તથા ૦૧ આસી.સીટી.એન્જી (ટેકનીકલ) ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડાયરેક્ટર(વિજ્ઞાનસ) મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિઝારાર્થે મૂકવામાં આવે છે.

### ૦૨. આસી.સીટી.એન્જી.(ટેક):-

- ખુનિ.કોપોરિશનની ટેકનીકલ કામગીરી સાથે સંકળાયેલ ખાતાઓની તપાસ ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- ઈજનેર ખાતાની કામગીરી માટે ખુનિ.કોપોરિશનનાં ૪ જોન તથા પ્રોજેક્ટ માટે ૦૨ આસી.સીટી.એન્જી.શ્રી (ટેક) ની નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓશ્રી દ્વારા ખુનિ.કોપોરિશન દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ, બીલ્ડિંગ, રોડ-રસ્તા, પાણી અને ગાઠરને લગતા નાગરીક સુવિધાના કામોનું ચેકીંગ તથા આવેલ ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવે છે. ઈજનેર ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીંગ કરવાની કામગીરી.
- રોડ પ્રોજેક્ટ, બ્રીજ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, હાઉસીંગ હોટ મીલ પ્લાન્ટ, એન.આર.સી.પી. એસ.એન.પી. વગેરે કામના મોનીટરીંગ તથા કવોલીટી ચેકીંગ તેમજ દરેક જોનમાં ટેન્ડરથી કરવાતા કામોનું ચુણવતાનું ચેકીંગ કરી તે અંગેના રિપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મુકવાની કામગીરી.

### ૦૩. ટેકનીકલ સુપરવાઈઝર:-

- આસી.સીટી.એન્જી.(ટેક)શ્રીના મદદનીશ તરીકેની તથા તેઓશ્રી તરફથી વખતો વખતો સોપવામાં આવતી કામગીરી અંગેનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- તદઉપરાંત વખતો વખતો ઉપરી અધિકારીશ્રી તરફથી સોપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

## ક. એસ્ટેટ/ટી.ડી.ઓ.વિભાગ:-

- એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાની કામગીરી માટે આસી.ભૂનિ.કમિશનર(વિજીલન્સ)તથા આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) સબ ઈન્સ્પેક્ટર(એસ્ટેટ-ટી.ડી.ઓ.) નિમણું કરવામાં આવેલ છે, જેઓ ભૂનિ. કોપોરિશનની હદમાં થતાં ગેરકાયદેસર બાંધકામ તથા દબાણોને લગતી આવેલ ફરીયાદોનો નિકાલ કરવાની કામગીરી કરે છે. એસ્ટેટ-ટી.ડી.ઓ. ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીંગ કરવાની કામગીરી.

### ૦૧.આસી.ભૂનિ.કમિશનર(વિજીલન્સ એસ્ટેટ-ટી.ડી.ઓ.)

- ભૂનિ.કમિશનરશ્રી,ડે.ભૂનિ.કમિશનર(વિજીલન્સ)તેમજ દરેક ઝોનના ડે.ભૂનિ.કમિશનરશ્રી તરફથી સોંપવામાં આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તેમજ નાગરીકો તરફથી આવતી ફરીયાદોનો તાકિદ નિકાલ કરવાની કામગીરી મેનેજરશ્રી દ્વારા કરવામાં આવે છે.
- વિજીલન્સ ખાતા (એસ્ટેટ-ટી.ડી.ઓ.)ની તમામ વહીવટી કામગીરી
- વિજીલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ ના આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટરને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મુકવાની કામગીરી.

### ૦૨.આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર (વિજીલન્સ એસ્ટેટ-ટી.ડી.ઓ.)

- સક્ષમ સત્તા દ્વારા વિજીલન્સ ખાતે મોકલવામાં આવતી ફરીયાદો બાબતે આસી.ભૂનિ.કમિશનરશ્રી(વિજીલન્સ) ની સીધી દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરી ચેકીંગ કરી સાચી હકીકતોનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- ભૂનિસિપલ કોપોરિશનના એસ્ટેટ-ટી.ડી.ઓ.ઓનાં અધિકારી / કર્મચારીઓ વિરુદ્ધ આવેલ ફરીયાદોની પ્રાથમિક તપાસ કરી તેનો હકીકતલક્ષી રિપોર્ટ આસી.ભૂનિ.કમિશનરશ્રી(વિજીલન્સ)દ્વારા સક્ષમ સત્તાને કરવો.
- ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી વખતો વખત સોંપવામાં આવે તે કામગીરી આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે.

### ૦૩.ઇન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.શ્રીના મદદનીશ તરીકે તથા એસ્ટેટ-ટી.ડી.ઓ.ખાતેથી ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અધિકારી / કર્મચારી વિરુદ્ધમાં આવતી તમામ ફરીયાદની તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવો.

#### ૦૪. સબ-ઇન્સ્પેક્ટર :- (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.અને ઇન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) ના મદદનીશ તરીકે તથા તેઓશી તરફથી વખતો વખત સોપવામાં આવતી કામગીરી કરવી.
- વિજ્ઞલન્સ વિભાગ (એસ્ટેટ-ટી.ડી.ઓ.) માં આવતી અરજીઓ ની નોંધણી કરવી, તપાસ રજીસ્ટર મેન્યુન્ટરન કરવું, ફાઈલોની જાળવણી અને નોંધણી મેન્યુન્ટરન કરવી.

**૨. દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી :-**

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા અમદાવાદ ભૂનિ.કોપોરિશન હસ્તકના તમામ ખાતાઓમાં વહીવટી કામગીરી ઉપર સતત ચેકીગ તથા હાજરી ચેકીગ અંગેની દેખરેખ રાખવામાં આવે છે. તેમજ કોઈપણ ખાતાના જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ આવેલ ફરીયાદમાં તપાસ કરી તથા જરૂર જણાયે સ્થળ તપાસ અંગેના રીપોર્ટો મેળવી વિજ્ઞલન્સ તપાસ અંગેનો સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને તે અહેવાલ ડે.ભૂનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) તરફ યોગ્ય હુકમ અર્થે મોકલવામાં આવે છે. સમગ્ર તપાસ અંગેનો નિર્ણય ડે.ભૂનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) દ્વારા લેવામાં આવે છે અને કલાસ- ૧, ૨ કક્ષાના અધિકારીના કેશમાં મે.ભૂનિ.કમિશનર સાહેબની મંજુરી મેળવી અને જો અધિકારી / કર્મચારી જવાબદાર જણાય તો શોકોઝ નોટીસ, ખાતાકીય તપાસની કાર્યવાહી અંગે યોગ્ય હુકમ મેળવવામાં આવે છે. અને ત્યાર બાદ આગળની કાર્યવાહી અર્થે રીપોર્ટ સાથે ફાઈલ અમદાવાદ ભૂનિ.કોપોરિશનના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે.

**૩. વિજ્ઞલન્સ ખાતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો :-**

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા કાર્યો બજાવવા અંગે અમદાવાદ ભૂનિ.કોપોરિશનના વહીવટની ગેરરીતીઓ અંગે, લાંચ રુશ્યત અંગે, ભૂનિ.કોપોરિશનના રૂલ્સ, બાયલોઝ કે નિતી નિયમો વિરુદ્ધ થયેલ કોઈ ગેર કાયદેસર કામગીરી બાબત, જાહેર જનતાની આવતી ફરીયાદો, વિગેરે બાબતો અંગે પ્રાથમીક તપાસ કરવાની હોય છે. જ્યાં આ પ્રકારની ગેરરીતીઓ કે અનિયમિતતા થયેલી અગર થતી માલુમ પડે ત્યાં પ્રાથમીક તપાસ પુર્ણ કરી રિપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ રજુ કરવામાં આવે છે. તદ્વારાંત વિજ્ઞલન્સ ખાતા દ્વારા ઈજનેર તથા ટી.ડી.ઓ. ખાતાને લગતી તેમજ ટેકનીકલ પ્રકારની ફરીયાદોની તપાસ આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ટેકનીકલ) દ્વારા કરવામાં આવે છે. ઈજનેર ખાતાના કર્મચારીઓનું હાજરી ચેકીગ તેમજ સ્ટોર, સબસ્ટોર, હોટમીક્ષ પ્લાન્ટનું ચેકીગ તથા ગેરકાયદેસર પાણી તેમજ ગટર કનેક્શનના કેસ બાબતે અને ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પગલાં લેવાતા ન હોય અથવા વિલંબ કરવામાં આવતો હોય તો તેની ફરીયાદો અંગેની તપાસ કરી તે બાબતે રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મુકવામાં આવે છે અને સક્ષમ સત્તાનો હુકમ મેળવી જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.

**૪. પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.**

- ભૂનિસિપલ કોપોરિશનના નિતી નિયમો તથા ધી બોમ્બે પ્રોવીન્સીયલ ભૂ.કોર્પો.એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

**૫. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક :-**

- અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન દ્વારા વખતો વખત અમલમાં આવતા નીતિ નિયમ અનુસાર દસ્તાવેજો જાળવવામાં આવે છે.

**૬. તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ ગોઠવણની વિગતો :-**

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

૭. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ?

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

૮. વિજ્ઞલન્સ ખાતા ના અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી પુસ્તીકા

અ.નં.	હોદ્દો	શીડ્યુલ મુજબ મંજુર થયેલ જગ્યાઓ	ભરાયેલ જગ્યાઓ	ખાલી જગ્યાઓ
૧.	ડે.ડાયરેક્ટર(વિજ્ઞલન્સ)	૧	૦	૧
૨.	આસી.સી.ટી.એન્ઝનીયર.	૬	૦	૬
૩.	આસી.સી.ટી.એન્ઝ. (ઈ એન્ડ એમ.)	૧	૦	૧
૪.	આસી.ટી.ડી.ઓ.	૧	૧	૦
૫.	આસી.મેનેજર	૨	૧	૧
૬.	વિજ્ઞલન્સ ઓફીસર (જનરલ)	૪	૨	૨
૭.	આસી.વિજ્ઞલન્સ ઓફીસર (જનરલ)	૧૪	૬	૮
૮.	એસ્ટેટ-ટી.ડી.ઓ.સબ ઈન્સ્પેક્ટર	૧	૧	૦
૯.	સીની.કલાર્ક	૩	૩	૦
૧૦.	જુની.કલાર્ક	૪	૩	૧
૧૧.	સ્ટેનોગ્રાફર	૧	૦	૧
૧૨.	ટાઇપીસ્ટ	૧	૦	૧
૧૩.	સર્વે બોય	૧	૦	૧
૧૪.	પટાવાળા	૪	૨	૨
	કુલ :-	૪૪	૧૮	૨૫

૬. તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કુર્મચારીઓને મળતા માસિક વળતર.:-

અનુ નં.	હોદ્દો	પે-બેન્ડ
૧.	૩.ડાયરેક્ટર (વિજીલન્સ)	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૨.	ટેલ્યુટી સીટી એન્જી.	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૩.	આસી.મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪.	આસી.સી.ટી.ઇઝનેર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૫.	આસી.ટી.ડી.ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૬.	વી.ઓ.	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૭.	ઇન્સ્પેક્ટર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૮.	સબ ઇન્સ્પેક્ટર	૩૮૮૦૦-૧૨૬૬૦૦
૯.	આસી.વિ.જી.ઓફીસર	૩૫૪૦૦-૧૧૨૪૦૦
૧૦.	સીની.કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૧.	જુની.કલાર્ક	૧૮૮૦૦-૬૩૨૦૦
૧૨.	પટાવાળા	૧૪૮૦૦-૪૭૧૦૦

૧૦. તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતું તેની દરેક એજન્સીઓ ફાળવેલ અંદાજ પત્ર.

વિજીલન્સ ડિપાર્ટમેન્ટ-કોમ્પ્યુટર કોડ-૧૨૦

સને. ૨૦૨૦/૨૧ (અંદાજીત) ના બજેટમાં વિજીલન્સ ડિપાર્ટમેન્ટની અંદાજેલ ખર્ચ.

અ.નં.	વિગત	અંદાજેલ ખર્ચ (રૂ.લાખમાં)
૧.	પગાર ખર્ચ	૧૩૪.૩૭
૨.	ટેલીફોન તથા ટ્રંકોલ (ઓફીસ)	૦.૫૦
૩.	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૪૦
૪.	સ્ટેશનરી	૦.૭૦
૫.	પ્રિન્ટીંગ	૦.૧૫
૬.	અન્ય ખર્ચ	૧.૭૦
૭.	યુનિફર્મ	૦૨૦
૮.	વાહનખર્ચ	૩.૦૦
૯.	પેટ્રોલ/ડિઝલ	૧૪.૦૦
કુલ :-		૧૫૫.૦૨

૧૧. ફાળવેલ રકમો, અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત.

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

૧૨. તેણે આપેલ છૂટ છાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

૧૩. ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહીતીને લગતી વિગતો.

- અત્રેના વિભાગની ફાઈલોમાં જેમાં ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં માહીતી ઉપલબ્ધ હોય તે જે તે સ્વરૂપમાં નિયત નિયમાનુસાર ફી ભરી મેળવી શકાય.

૧૪. જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહીતની માહીતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.

- આ વિભાગમાં કોઈ ગ્રંથાલય નથી.

૧૫. જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો.

૧. શ્રી અંકિતા એમ મોદી  
જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજી.જનરલ)  
અમદાવાદ મ્યુનિ.કોપેરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૫૪,
૨. શ્રી શૈલેષભાઈ ભડ્ક  
જાહેર માહિતી અધિકારી અને આસી.સીટી.એન્જી. (ટેકનીકલ)  
અમદાવાદ મ્યુનિ.કોપેરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૮
૩. શ્રી સંજયભાઈ ગજજર  
જાહેર માહિતી અધિકારી અને (ઇન.ચાર્જ)આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.  
અમદાવાદ મ્યુનિ.કોપેરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

પ્રકરણ-૫ અપીલ અધિકારીશ્રીનું નામ તથા હોદ્દો :-

શ્રી હીના એસ ભાથાવાલા,  
અપીલ અધિકારી અને ડાયરેક્ટર / હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (વિજ્ઞલન્સ),  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, બીજો માળ,  
દાઢાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૯૯૮૯૯ / ૬૫૮

**૧૬. ઠરાવવામાં આવે તેવી બીજી માહીતી :-**

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

